

RAN-2308000106051001

T.Y.B.Com. (Non NEP) (Sem. VI) Examination March - 2026
Advance Accounting and Auditing (Paper - VII)

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. (અ) આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
10

- ફોજદારી અંગે ઓડિટરની જવાબદારી નક્કી કરવાના હેતુ માટે નીચેના પૈકી કયા મુદ્દા સુસંગત છે?
 - વિજ્ઞાપનપત્રમાં સાચું નિવેદન કરે
 - સરકારે નિમેલા ઈન્સ્પેક્ટરને જરૂરી માહિતી ન આપે
 - સરકારે નિમેલા ઈન્સ્પેક્ટરને જરૂરી મદદ કરે
 - ફોજદારી ગુના બદલ તે નિર્દોષ ઠરે
- જે નફો કાયદેસર રીતે શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય એવા નફાને કહે છે.
 - વહેંચણીપાત્ર નફો
 - અપેક્ષિત નફો
 - અધિક નફો
 - મૂડી નફો
- નીચેના પૈકી કયા સંજોગોમાં ખામીવાળો અહેવાલ આપી શકાય?
 - નફા-નુકસાન ખાતું અને પાકું સરવૈયું કાયદા મુજબ બનાવેલ હોય
 - કંપનીએ કંપનીધારા મુજબ હિસાબના ચોપડા રાખ્યા હોય
 - ઓડિટીંગના સ્વીકૃત ધોરણોનું પાલન
 - કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન
- કંપનીધારા - 2013 મુજબ ઓડિટરની પ્રથમ નિમણૂક બોર્ડ ઓફ ડાયરેક્ટર કંપનીની નોંધણી થયાના કેટલા દિવસમાં કરે છે?
 - 30
 - 35
 - 40
 - 60
- અન્વેષકનો અહેવાલ રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ?
 - અહેવાલ સમયસર રજૂ કરવો
 - અહેવાલ સરળ ભાષામાં
 - અહેવાલ કાળજીપૂર્વક તૈયાર કરવો
 - ઉપરોક્ત બધા
- જેનો ઉદ્દેશ કોઈ શુભ હેતુને આગળ વધારવાનો અને તે દ્વારા સમાજને લાભ મળે તે હોય
 - જાહેર ટ્રસ્ટ
 - ખાનગી ટ્રસ્ટ
 - જાહેર કંપની
 - ખાનગી કંપની
- સારો ઓડિટ અહેવાલ નીચેના પૈકી કયું લક્ષણ ધરાવે છે?
 - શીર્ષક
 - સંબોધન
 - ફકરામાં વહેંચાયેલ
 - ઉપરોક્ત બધા
- કરવેરાધારા-1961 ની કઈ કલમ કરવેરા ઓડિટની જોગવાઈઓને લાગુ પડે છે?
 - કલમ 44 AB
 - કલમ 45 AB
 - કલમ 46 AB
 - કલમ 47 AB

9. NFRA નું પૂરું નામ
 A. National Financial Reporting Authority
 B. National Fact Report Authority
 C. National Foreign Reporting Authority
 D. ઉપરોક્ત એકેય નહીં
10. બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે જાહેર કરવામાં આવતું ડિવિડન્ડ
 A. વચગાળાનું ડિવિડન્ડ
 B. છેવટનું ડિવિડન્ડ
 C. અંશતઃ ડિવિડન્ડ
 D. ઉપરોક્ત એકેય નહીં

પ્ર.1. (બ) યોગ્ય જોડકા જોડો :

05

1. ઓડિટ કાર્યક્રમ	(અ) તપાસની એક વિગતવાર યોજના
2. ઓડિટ અહેવાલ	(બ) હિસાબો તપાસ્યા બાદ અભિપ્રાય
3. અન્વેષણ	(ક) અમુક વિશિષ્ટ હેતુ માટેની તપાસ
4. નાણાંકીય ઓડિટ	(ડ) કંપની માટે ફરજિયાત છે
5. ઓડિટ પ્રમાણપત્ર	(ઈ) કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી

પ્ર.2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (ગમે તે ચાર)

08

1. ઓડિટરની ગેરલાયકાતો જણાવો.
2. ઓડિટરની જવાબદારીના પ્રકારો જણાવો.
3. નફો ઓછો બતાવવાની અસરો જણાવો.
4. અન્વેષણ એટલે શું?
5. ઓડિટ કાર્યક્રમનું મહત્વ જણાવો.
6. ઓડિટ અહેવાલના પ્રકારો જણાવો.
7. કરવેરા ઓડિટની જોગવાઈઓ જણાવો.
8. પડતર ઓડિટનો અર્થ આપો.

પ્ર.3. (અ) આર્ટસ્ કોલેજનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો.

07

પ્ર.3. (બ) ધંધો ખરીદનાર વતી અન્વેષણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જણાવો.

06

અથવા

પ્ર.3. (અ) ઓડિટરની ફોજદારી જવાબદારી ચર્ચો.

07

પ્ર.3. (બ) ઓડિટરના હકો સમજાવો.

06

પ્ર.4. (અ) ટૂંકનોંધ લખો (ગમે તે બે)

08

1. વહેચણીપાત્ર નફાની ગણતરીની માર્ગદર્શક બાબતો
2. ઓડિટ પ્રમાણપત્રનું મહત્વ
3. કરવેરા ઓડિટના હેતુઓ
4. EDP ઓડિટ

પ્ર.4. (બ) તફાવત લખો (ગમે તે એક)

06

1. ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલ
2. નફો અને વહેચણીપાત્ર નફો

ENGLISH VERSION

Q.1. (A) Choose the correct Option:

10

- (1) Which of the following issues are relevant for the purpose of determining the auditor's liability for criminal liability?
(A) Make a true statement in the prospects.
(B) Not to provide necessary information to the government nominated inspector.
(C) To provide necessary assistance to the government nominated inspector
(D) He was found not guilty of a criminal offense.
- (2) Profits that can be legally distributed among shareholders as dividends are called profits.
(A) Distributable profit (B) Expected profit
(C) Divisible Loss (D) Capital gains
- (3) Under which of the following circumstances can a qualified report be given?
(A) Profit & loss account and Balance sheet prepared as per law
(B) The company has maintained books of accounts as per company rules.
(C) Compliance with accepted auditing standards
(D) Violation of the provisions of the Companies Act
- (4) According to the Companies Act-2013, the first appointment of an auditor is made by the Board of Directors within how many days of the registration of the company?
(A) 30 (B) 35
(C) 40 (D) 60
- (5) What things should be taken into consideration while presenting an investigator's report?
(A) Submitting the report on time (B) Report in simple language
(C) Prepare the report carefully. (D) All of the above
- (6) The purpose of which is to further a good cause and thereby benefit to the society.
(A) Public Trust (B) Private Trust
(C) Public Company (D) Private Company
- (7) A good audit report has which of the following characteristics?
(A) Title (B) Addressee
(C) Divided into paragraphs (D) All of Above
- (8) Which Section is relating to tax audit of income tax act-1961
(A) 44 AB (B) 45 AB
(C) 46 AB (D) 47 AB
- (9) Full form of NFRA
(A) National Financial Reporting Authority
(B) National Fact Report Authority
(C) National Foreign Reporting Authority
(D) None of the above
- (10) Dividend declared between two annual general meetings is called
(A) Interim dividend (B) Final dividend
(C) Partial dividend (D) None of the above

Q:1 (B) Match the following.

05

1. Audit program	(A) A detailed plan of investigation
2. Audit report	(B) Opinion after examining the accounts
3. Investigation	(C) Investigation for some specific purpose
4. Financial Audit	(D) Compulsory for Company
5. Audit Certificate	(E) Nor addressed to the any party

Q:2	Write the following answers in short. (Any Four)	08
(1)	State the disqualifications of the auditor.	
(2)	State the types of auditor's responsibilities.	
(3)	Explain the effects of showing less profits.	
(4)	What do you mean by Investigation?	
(5)	Give the importance of Audit Programme.	
(6)	Write the types of Audit Report.	
(7)	Explain the provisions of tax audit.	
(8)	Give the meaning of Cost Audit.	
Q:3(A)	Prepare a Audit Programme of Arts College.	07
Q:3(B)	Explain the points to keep in mind while investigation on behalf of an intending purchaser of a business.	06
	OR	
Q:3 (A)	Discuss the criminal liability of auditors.	07
Q:3 (B)	Explain the rights of an auditor.	06
Q:4 (A)	Write a short note (Any Two)	08
(1)	Guidelines for computing Divisible profits	
(2)	Importance of Audit Certificate	
(3)	Objectives of Tax Audit	
(4)	EDP Audit	
Q:4 (B)	Specify the difference (Any One)	06
(1)	Clean Report and Qualified Report	
(2)	Profit an Divisible Profit	